



## ભરત રસસૂત્રના ભાષ્યકારો

ડૉ. દીક્ષા એચ. સાવલા

અધ્યક્ષા: અનુસ્નાતક સંસ્કૃતવિભાગ

શ્રી જે. એમ. પટેલ. પી. જી. સ્ટીલ ઓન્ડ

રીસર્ચ ઈન લ્યુમિનીટિઝ, આણંદ

### ૧. પ્રસ્તાવના

કાવ્યશાસ્ત્રના મહાવાક્યરૂપ ભરતસૂત્રનું બિન્ન-બિન્ન દાર્શનિક ભૂમિકાએ રહીને અનેક વ્યાખ્યાકારોએ જુહું-જુહું અર્થધટન કર્યું છે. રસસૂત્રનું સ્વકીય દાર્શનિક પરિપ્રેક્ષયમાં અર્થધટન કરીને વિવિધ વ્યાખ્યાકારોએ પોતાના મૌલિક સિધ્યાંતો સ્થાપિત કર્યો છે. આપણે કેવળ અભિનવભારતીનો આધાર બનાવ્યો હોવાથી ભરૂ લોલટ, શુંકુક, ભરૂતૌત, ભરૂનાયક, અભિનવગુપ્તના ઉત્પત્તિવાદ, અનુમિતિવાદ, લુક્ષિતિવાદ અને અભિવ્યક્તિવાદની મીમાંસા જોઈએ.

### ૨. ભરૂ લોલટ ઉત્પત્તિવાદ અને દંડી: ઉપચિતિવાદ

ભરૂ લોલટના ઉત્પત્તિવાદના મુખ્ય તત્ત્વો આ પ્રમાણે છે:

૧. વિભાવ-અનુભાવ-વ્યભિચારીભાવોનો સ્થાયીભાવ સાથે સંયોગ થતાં રસની ઉત્પત્તિ થાય છે.
૨. વિભાવાદિ અને સ્થાયીભાવ વચ્ચેના સંયોગનું સ્વરૂપ ઉત્પાદક-ઉત્પાદ સંબંધનું હોય છે.
૩. વિભાવાદિ અને સ્થાયીભાવ વચ્ચેના સંયોગનું સ્વરૂપ પરિપોષક-પરિપોષ સંબંધનું હોય છે.
૪. વિભાવ, અનુભાવ અને વ્યભિચારીભાવો પૈકી વિભાવ, સ્થાયીભાવની ઉત્પત્તિનું કારણ હોય છે.
૫. લોલટ અનુભાવને રસોત્પત્તિનું કારણ માનતા હોવાથી અનુભાવ શરીરથી તેમને રસજન્ય કટાક્ષાદ્રૂપ અનુભાવો અભિપ્રેત નથી.
૬. લોલટ રસના કારણભૂત અનુભાવો સ્થાયીભાવ પદ્ધીથી ઉત્પન્ન થતાં હોવાથી એમની AZMID એવી સંજ્ઞા સાર્થક છે.
૭. લોલટ નિર્વદાદિ વ્યભિચારીભાવોને સ્થાયીભાવના સંસ્કરણે રહેલા માને છે.
૮. આમ રસરૂપે રહેલા સ્થાયીભાવ સાથે નિર્વદાદિ વ્યભિચાર ભાવ સંસ્કરણે જ રહેતા હોય છે.
૯. રામાદિ અનુકાર્યમાં મુખ્યરૂપે અભિધારૂપક સ્થિતિ તો અનુકાર્ય એવા રામાદિ મૂળપાત્રોમાં જ હોય છે.
૧૦. લોલટ રસપ્રતીતિમાં ક્યાંય પ્રેક્ષકનો વિચાર કરતા નથી. પ્રેક્ષકને રસની પ્રતીતિ કેવી રીતે ને કેવા સ્વરૂપે થાય છે તે લોલટ મૂકી ગયાં છે.

દંડી લોલટની જેમ જ રૂપબાહુલ્યનો સિધ્યાંત રજૂ કરે છે. તેમના ઉપચિતિવાદના મુખ્ય તત્ત્વ આ પ્રમાણે છે:

૧. રતિ: આદિ સ્થાયીભાવ રૂપબાહુલ્યને લીધે શુંગારાદિ રસતત્વને પામે છે. અહીં રૂપબાહુલ્ય એટલે જાતજાતના વિભાવ, અનુભાવ, સાન્નિકભાવ અને વ્યભિચારી ભાવોથી રતિ આદિ સ્થાયીભાવોના રૂપમાં પ્રકટતું બાહુલ્ય કે પ્રાચ્યર્ય દંડીને અભિપ્રેત છે, કેમકે રતિ આદિ સ્થાયીભાવરૂપે હોય છે ત્યારે અવ્યક્ત તથા કેવળ સંસ્કાર કે વાસનારૂપે જ રહેલા હોય છે.
૨. કોધ: આદિ (ઓજસ પૂર્ણ) સ્થાયીભાવો અત્યંત વૃદ્ધિ પામીને અથવા તો અત્યંત તીવ્ર બનીને કે પરાકાણા પામીને રૌદ્રાદિ રસતત્વને પામે છે. સ્થાયીભાવની પરિવૃદ્ધિ કે અતિ તીવ્રતા કે પરાકાણા વૈચિત્રયભર્યા વિભાવ, અનુભાવ, સાન્નિકભાવ અને વ્યભિચારી ભાવોના સ્થાયીભાવ સાથેના સંયોગથી સંભવે છે. અહીં વિભાવાદિ સ્થાયીભાવના પરિવર્ધકરૂપે સંયોજય છે.

### 3. શંકુક: અનુમતિવાદ

શંકુક અનુકૃતિમાણ સ્થાયીભાવની અનુમતિને રસ માને છે. તેમના અનુમતિ સિદ્ધાંતમાં.....

(૧) રામ આદિ મૂળપાત્રો (અનુકર્ય)ના સ્થાયીભાવનું નટ (અનુકર્તા) દ્વારા થતું અનુકરણ અને

(૨) નટ દ્વારા અનુકરણ પામેલા સ્થાયીભાવનું પ્રેક્ષકને થતું અનુમાનમૂલ જ્ઞાન-પ્રતીતિ એ-બે તત્ત્વો મહત્ત્વના છે.

આમ આ પ્રકાર શંકુકનો મત એ છે કે રસ અનુકરણરૂપ હોય છે.

### ૪. ભંડતૌત

ભંડતૌત શંકુકના મતનું ખંડન કરે છે. અભિનવભારતીમાં અભિનવગુપ્તે ગુરુભંડતૌતને શંકુકના મતનો પ્રબલ વિરોધી બતાવે છે. અનુમાન હેતુની વિશુદ્ધ પર આશ્રિત હોય છે.

૧. કોઈ વસ્તુ પ્રમાણભૂતરૂપે સામે હોય ત્યારે જ તેનું અનુકરણ થઈ શકે. પરંતુ નટમાં એવી કોઈ વસ્તુ નથી, જે સ્થાયીભાવના અનુકરણરૂપે પ્રેક્ષકને પ્રતીત થાય. કેમકે નટનું શરીર કે પછી નટના શરીર પરના મુકુટાદિ કે પછી નટના રોમાંચ ભુજાક્ષેપાદિ અનુભાવ-પૈકીની કોઈપણ વસ્તુ ચિત્તવૃત્તિરૂપે રહેલા સ્થાયીભાવના અનુકરણરૂપે પ્રેક્ષકને પ્રતીત થતા નથી.

૨. સ્થાયીભાવ અને મુકુટ નટ શરીર- કટાક્ષાદિ એકબીજથી અત્યંત બિન્ન હોવાને કારણે મુકુટાદિને સ્થાયીભાવના અનુકરણરૂપે માની શકાય નહીં. કેમકે સ્થાયીભાવ ચેતન છે તો મુકુટાદિબાવ જરૂર છે. સ્થાયીભાવ મનથી ગ્રહણ થાય છે, મુકુટાદિ નેત્રાદિ ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે. સ્થાયીભાવનું અધિક્ષાન મન છે. તો મુકુટાદિનું અધિક્ષાન શરીર છે. આમ સ્થાયીભાવ અને ભુજાક્ષેપાદિ અનુભાવો અત્યંત બિન્ન હોવાથી તે સ્થાયીભાવના અનુકરણ હોઈ શકે નહીં.

૩. અનુકરણની પ્રતીતિ રામાદિ અનુકર્તા અને નટના અભિનવરૂપ અનુકરણ એ બંનેને નિહાળીને જ થઈ શકે. પરંતુ રામમાં રહેલા રતિરૂપ મુખ્ય અનુકર્યને નવી પ્રેક્ષકોમાંથી કોઈએ નિહાળ્યો કે નથી નટે નિહાળ્યો માટે નટ રામનું અનુકરણ કરે છે, એ ધારણાનો આપોઆપ જ છેદ ઉડી જય છે.

### ૫. ભંડનાયક: ભુક્તિવાદ

ભંડનાયક ઉપર્યુક્ત વાટનું ખંડન કરે છે. ભંડનાયક રસસૂત્રમાં યોજયેલા  $g\int \frac{dV}{dt} V^2$  નો અર્થ સ્થાયીભાવ અને વિભાવાદિ વર્ચ્યે ભોજન્ય-ભોજકભાવ સંબંધરૂપ સંયોગ એવો કરે છે. તેઓ { $Z \int dV$ }...નો અર્થ ‘ભુક્તિ’ કરે છે. ભંડનાયક રસતત્ત્વને અપ્રમેય માને છે. તેમના મતે સહદ્ય રસનો ભોક્તા હોય છે.

ભંડનાયક અભિધા, ભાવના અને ભોગ-અભે ત્રાગ શબ્દાર્થ શક્તિને માને છે. આમ તો રસની ભુક્તિનો વ્યાપાર અખંડ હોય છે. આથી ભંડનાયક અભિધા, ભાવના અને ભોગરૂપ શબ્દશક્તિઓને અખંડ નાટ્યવ્યાપારના ત્રાગ અંશ કે ત્રાગ તબક્કારૂપે જ જુએ છે.

સૌ પ્રથમ અભિધારૂપે નાટ્યવ્યાપાર આરંભાય છે. અભિધાવ્યાપારથી આલંબન-ઉદ્દીપન વિભાવો, સાત્ત્વિકભાવો પ્રકટ થાય છે. સાથે જ ઘટના વિષયવસ્તુ ઈતિવૃત્તનો પરિચય થાય છે અને નાટ્યમાં આંગિક, વાચિક, સાત્ત્વિક અને આહાર્યરૂપ ચતુર્વિધ અભિનવરૂપે વિસ્તરે છે. ભાવના વ્યાપાર સામાજિકમાં રહેલા ગાઢ મોહનું નિવારણ કરે છે. ભાવના વ્યાપાર બાદ ભોગવ્યાપારરૂપે નાટ્યવ્યાપારનો અંતિમ ચરમ તબક્કો આરંભાય છે. એમાં અનુભવ સ્મૃતિ આદિથી સાવ વિલક્ષણ ચેતોવસ્થા પ્રકટ થાય છે. એમાં રજેગ્યુલા અને તમોગુણના અનુવેદ્ય (સંમિશ્રાંગથી) ના વૈચિન્યના બળે ચિત્ત દ્વારા હોય તથા વિકસિત થતું હોય એવો અનુભવ થાય છે. એ વેળા સત્ત્વગુણનો ઉદ્દેશ થવા લાગે છે. પરિણામે સામાજિકનું સંવિદ્પ પ્રકાશ અને આનંદમય સાક્ષાત્કારમાં વિશ્વાન્તિ પામે છે. આમ આલંબન-ઉદ્દીપન વિભાવોને વિષયવસ્તુના કથન સાથે શરૂ થયેલો નાટ્યવ્યાપાર સંવિદ્પ રસના ભોગમાં પરિણાતિ પામે છે.

## ૫. ૧ અભિનવગુપ્ત: અભિવ્યક્તિવાદ

અભિનવગુપ્ત અભિવ્યક્તિવાદની માંડળી પુરોગામી આચાર્યાના મતોના ખંડનને બદલે સંશોધનનો અભિગમ અપનાવીને કરે છે. તેમણે પૂર્વાચાર્યાના સિદ્ધાંતની રસવ્યાપારના વિરુદ્ધ માટે સંગતિ રચવી, એને મૌલિક સિદ્ધાંતની સ્થાપના જેટલી જ મહત્ત્વ આપી છે. અભિનવગુપ્તની વિચારણા જોઈએ તો:

૧. સર્વક પ્રતિભાના બળે વિભાવ-અનુભાવ-સાત્ત્વિકભાવ સાધારણીકરાગ પામે.
૨. સાધારણીકૃત વિભાવાદિના સંયોગે સહદ્યમાં રહેલો સ્થાયીભાવ જગત થાય.
૩. એ સ્થાયીભાવ પણ સાધારણીકૃત હોય, કેમકે વિભાવાદિની જેમજ સ્થળ-કાળ અને વ્યક્તિ વિશિષ્ટના સંબંધોથી મુક્ત હોય છે.
૪. એથી જ તો ચિત્તમાં સુષુપ્તદ્રષ્ટે સંચિત સ્થાયીથી રસ સ્વરૂપત: બિન્ન સંવિતિ ગાગાઈ છે.
૫. રસાનુભવ વેળા સામાન્યિકનો સંકુચિત અહ્મ તિરોભૂત થાય છે અને બ્યાપક સંવિતિનો આવિર્ભાવ થાય છે.
૬. આ સાધારણીકૃત સ્થાયી જે અપરિચિત સંવિદ્ધ રૂપે પ્રકટે તે જ રસ કહેવાય.
૭. આ રસ પ્રતીતિ વિભાવાદિનો સંયોગ થતાં પ્રકટે અને સંયોગ રહે તાં સુધી ટકે છે.
૮. આથી જ ભરત રસસૂત્રમાં સ્થાયીનો ઉલ્લેખ કરતા નથી.
૯. અભિનવગુપ્ત રસને સ્થાયીભાવથી વિલક્ષણ માને છે. એમાં સામાન્યિકની બોધમય સંવિતિનો પ્રસાર થાય છે.
૧૦. રસાનુભવ માટે સામાન્યિકમાં તાદાત્મય તાટસ્થ્ય હોવું જોઈએ.

## ૫. ૨ રસસૂત્રનું સારભૂત વિવેચન

અભિનવગુપ્ત સમગ્ર ચર્ચાને અંતે સારાંશ રજૂ કરે છે:

૧. નાટકમાં અનુકાર્ય (રામ)ની વેશભૂષાને અનુરૂપ નટ દ્વારા ધારાગ કરાયેલા મુક્ત આદિ દ્વારા સૌ પ્રથમ પ્રેક્ષકની નટબુદ્ધિ આચ્છાદિત થઈ જાય છે.
૨. પૂર્વકાળના ગાઠ જ્ઞાન, સંસ્કારો અને કાવ્ય દ્વારા બળપૂર્વક આણગવામાં આવેલી રામબુદ્ધિ (આ નટ રામ છે એવી પ્રતીતિ) સ્થિર થતી નથી.
૩. આ બંનેને પરિણામે નટ તથા રામ એ બંને સાથે જોડાયેલા દેશ-કાળ, વૈયક્તિક સંદર્ભ વગેરેનો પરિત્યાગ થઈ જાય છે.
૪. લોકવ્યવહારમાં જે વ્યાભિચારીભાવ મોટેભાગે રતિની પ્રતીતિ કરાવનારદ્રષ્ટે જેવા મળે છે. તથા તે વ્યાભિચારિભાવ રોમાંચ આદિ અનુભાવ નટમાં દેશકાળના સંદર્ભથી મુક્ત થઈ રતિનો બોધ કરાવે છે.
૫. રતિની આવી પ્રતીતિમાં સામાન્યિકનો, પોતાનો આત્મા પણ સહદ્યથીલ હોવાને કારણે વશીભૂત થાય છે. આથી તેને રતિનું જ્ઞાન તટસ્થ રૂપે થતું નથી કે નથી તેને રામસીતા આદિરૂપ નિશ્ચિત કારણોથી થતું પરિણામે રસવિદ્ધનો દૂર થાય છે. એ જ રીતે એને નટમાં રહેલી રતિનું પણ જ્ઞાન થતું નથી. પરિણામે દુઃખ, દ્વેષ વગેરે એનામાં જરૂરતા નથી. આથી જ કાળિકવાદી બૌધ્ધ જેને ચિત્તવૃત્તિ પ્રવાહરૂપ રતિ શુંગાર રસ કહેવાય છે. એ જ રીતે સ્થિરતાવાદી નૈયાયિકોના મતે એક જ જ્ઞાનની વિષયભૂત રતિ શુંગાર કહેવાય છે. રતિનું આવું સાધારણીકરાગ વિભાવ આદિ દ્વારા સંભવે છે.

આમ અભિનવગુપ્તે સ્થાયીભાવ કેવી પ્રક્રિયાથી રસમાં રૂપાંતરિત થાય છે તેનું સૂક્ષ્મ વિશ્વેષણ કર્યું છે. તેમના મતે રસોત્કર્ષ પ્રબંધ કાવ્યોમાં સંભવે છે. પ્રબંધ કાવ્યો પૈકી દર્શાપ્રકમાં જ તે પૂર્ગપાણે પ્રકટ થાય છે.

## સંદર્ભથંથ

૧. A{^ZdJW ÜdY` mbo\$bmZ Mm| à~mgH\$V grarO Am\\$g, ~Zmag, 1940

2. લિનીર્સ, CX^Q>g§ (1966). અમિત્વચંહણગંગાજીહ એદ્સ બકુલિમ હસ ઇંમા`મ {હિન્દુ ગ્રંથો`  
ગ્રંથોઝ, આ`મા.
3. રાહુલ, આદોવ (2008). જીવનેની નીમોધારીનેચેર્ચ ના અમ. અહિનીન્દ્રા
4. ઉદ્દીપ, હોમર આગ્રન્ધ (1971). જીવનેની હસ માન્વરી` નાનામાનોદ્દુંબ આહીનેચેર્ચ, ક્ષેત્ર.
5. નીસ્ય, આવ ગં (1943). હોમરાની જીવનેની ગ્રંથો` માન્વરી` નાનામાનોદ્દુંબ આહીનેચેર્ચ, ક્ષેત્ર.
6. \_\_\_\_\_. (2008). આદોવ રાહુલજીવનેની નીમોધારીનેચેર્ચ, અહિનીન્દ્રા.
7. \_\_\_\_\_. (1982). અમ. એ. જીવનાંબ નાભરાયીંગ, ક્ષેત્ર.
8. \_\_\_\_\_. (1946). અમિત્વચંહણ હસદ જીવનેની - મા-1 અમિત્વચંહણ બિનોફિલો` - સાધારણ.
9. નાન્દુંબ, સાધારણ અન્યાન્ય ગં (1969). ઉદ્દીપ નાન્દુંબ જીવનેની વિદેશો, અહિનીન્દ્રા-9.
10. Kumar, Sushil (1960). History of Sanskrit Poetics Firms J.K. Mukhopadhyay Publishers, Calcutta- 12.
૧૧. ટાકોર, અનિત (૧૯૮૨). કાવ્યાર્થ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ.
૧૨. \_\_\_\_\_. (૨૦૦૬). કવિ સમય, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ.
૧૩. \_\_\_\_\_. (૧૯૯૦). વિસર્ગ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર.
૧૪. \_\_\_\_\_. (૧૯૯૫). સિથ્યંતર પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ.
૧૫. તપસ્વી, નાન્દી (૧૯૮૪). ભારતીય સાહિત્ય શાસ્ત્રની વિચાર પરંપરાઓ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત. બી. આ.